

જીવનના જીવન, મારા પ્રકાશના પ્રકાશ, તું મને સતત પ્રેમના પાઠ શીખવી રહ્યો છે અને મારા અસ્તિત્વનું કારણ મને તે સમજાવ્યું છે.

... ..

A new door has opened ...

... ..

A new door has opened in my being and an immensity has appeared before me.

I cross the threshold with devotion, feeling hardly worthy yet of entering upon this hidden path, veiled to the sight and as though invisibly luminous within.

All is changed, all is new; the old wrappings have fallen off and the new-born child half-opens its eyes to the shining dawn.

એક નવું દ્વાર ખૂલ્યું છે...

મારા સ્વરૂપમાં એક નવું દ્વાર ખૂલ્યું છે અને મારી સમક્ષ એક વિરાટતા પ્રગટ થઈ છે.

હું ભક્તિ ભાવે ઉંબર ઓળંગું છું, અને મને લાગે છે કે આ દૃષ્ટિથી છુપાયેલા, અને જાણે કે અંદરમાં અદૃશ્ય રીતે તેજોમય એવા, આ ગુપ્ત માર્ગ પર પગ ધરવાને હું ભાગ્યે જ લાયક છું.

સર્વ કાંઈ બદલાઈ ગયું છે, સર્વ કાંઈ નવું બની ગયું છે; જૂના વાઘા સરી પડ્યા છે અને નવું જન્મેલું બાળક ઉષાના પ્રકાશ તરફ પોતાની આંખો અર્ધીપર્ધી ખોલી રહ્યું છે.

[Prayers and Meditations: 1913: 2 Aug - 17 Aug - 7 Oct]

[પ્રાર્થનાઓ અને ધ્યાન: ૧૯૧૩: ૨ ઓગસ્ટ - ૧૭ ઓગસ્ટ - ૭ ઓક્ટોબર]



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2017

JULY

૧ જુલાઈ ૨૦૧૭

— શ્રી માતાજીની ત્રણ પ્રાર્થનાઓ —

— Three Prayers of The Mother —

In a calm as of deep waters ...

This morning, as I was glancing over the month that is beginning and wondering how I could serve Thee better, I heard the small voice within like a murmur in the silence, and this is what it said to me: “See how very little all outer circumstances matter. Why strive and strain so to realise thy own conception of Truth? Be more supple, more trusting. The only duty is not to let oneself be troubled by anything. To torment oneself about doing the right thing causes as much harm as a bad will. Only in a calm as of deep waters can be found the possibility of True Service.”

And this reply was so luminous and pure, it carried within itself such a striking reality, that the state it described was communicated without any difficulty. It seemed to me I was floating in the calm of deep waters; I understood; I saw clearly what the best attitude would be; and now I have only to ask Thee, O Sublime Master, my Supreme Teacher, to give me the strength and clear-sightedness I need to remain constantly in this state.

... ..

From:Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. ©0413-2331470

રવાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨ ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • July 2017

ઊંડા પાણી જેવી સ્થિરતામાં ...

આજે સવારે, આ શરૂ થતા માસ ઉપર હું નજર નાખતી હતી ત્યાં મને પ્રશ્ન થયો કે તારી સેવા કરવા માટેનું સર્વોત્તમ સાધન કયું છે અને મેં પેલો નાનકડો આંતર અવાજ સાંભળ્યો, નીરવતામાં પ્રગટતા એક મર્મર જેવો, અને તેણે મને કહ્યું: ‘જો, બાહ્ય સંજોગોનું મહત્ત્વ કેટલું બધું ઓછું છે? સત્ય વિષેની તારી જે કલ્પના છે તેને સાકાર કરવાના તારા પ્રયત્નમાં તું કેમ મથી રહી છે અને તેમાં આગ્રહી બની રહી છે? વધુ મુલાયમ બન, વધુ વિશ્વાસમય બન. કશાથી પણ તારી જાતને ગભરાવા ન દેવી એ જ એકમાત્ર તારે કરવાનું છે. સાચું કરવા માટે પોતાની જાતને રિબાવ્યા કરવામાંથી આવતાં પરિણામ તે અશુભ ઇચ્છામાંથી આવતાં પરિણામો જેટલાં જ ખરાબ હોય છે. ઊંડાં પાણીમાં જે સ્થિરતા રહેલી છે તેમાં જ સાચી સેવાની એકમાત્ર શક્યતા રહેલી છે.’

અને આ ઉત્તર એવો તેજોમય અને એવો તો નિર્મલ હતો, એનામાં એવી તો અસરકારક વાસ્તવિકતા રહેલી હતી કે આ વર્ણવેલી અવસ્થા કશી મુશ્કેલી વિના મારામાં આવી ગઈ. મને લાગ્યું કે જાણે એ ઊંડાં પાણીની સ્થિરતામાં તરી રહી છું. મને સમજણ પડી; મને સ્પષ્ટ રીતે દેખાયું કે સારામાં સાચું વલણ શું હોય; અને મારે તો તારી પાસે માત્ર આટલું જ માગવાનું રહે છે કે, હે પરમોત્તમ પ્રભુ, મારા પરમ શિક્ષાદાતા, આ અવસ્થામાં હું સતત ટકી રહું તે માટે જરૂરી હોય તેટલી શક્તિ અને આંતરદૃષ્ટિ આપ.

... ..

Soar very high above ...

O LORD, Master of our life, let us soar very high above all care for our material preservation. Nothing is more humiliating and depressing than these thoughts so constantly turned towards the preservation of the body, these preoccupations with health, the means of subsistence, the framework of life. . . . How very insignificant is all this, a thin smoke that a simple breath can disperse or a single thought turned towards Thee dispel like a vain mirage!

Deliver those who are in this bondage, O Lord, even as those who are the slaves of passion. On the path that

leads to Thee these obstacles are at once terrible and puerile – terrible for those who are yet under their sway, puerile for one who has passed beyond.

How shall I describe that utter relief, that delightful lightness which comes when one is free from all anxiety for oneself, for one’s life and health and satisfaction, and even one’s progress?

This relief, this deliverance Thou hast granted to me, O Thou, Divine Master, Life of my life and Light of my light, O Thou who unceasingly teachest me love and makest me know the purpose of my existence.

... ..

ઉપર ઘણે ઊંચે ઊડવા ...

હે પ્રભુ, હે અમારા જીવનસ્વામી, અમારા સ્થૂલ જીવનને સાચવવાની ચિંતામાંથી અમને ઊંચે ને ઊંચે ચાલી જવા દે. શરીરને સાચવવું, તબિયત વિષેના વિચારો કર્યા કરવા, જીવનના નિર્વાહ અંગેના, જીવનની ઘટમાળ અંગેના વિચારો હંમેશાં કર્યા કરવા એના કરતાં વિશેષ હીણપત કરનારી, વિશેષ ગ્લાનિ કરનારી વસ્તુ બીજી કોઈ જ નથી... આ બધું કેટલું તો ક્ષુદ્ર છે, એક પાતળા ધુમાડા જેવું છે કે જેને તારા પ્રત્યે વળેલો માત્ર એક જ વિચાર વ્યર્થ ઝાંઝવાની માફક વિખેરી નાંખે છે.

આ ગુલામીમાં જે પડી રહેલા છે તેમને મુક્ત કર, હે પ્રભુ, અને જેઓ વાસનાઓની ગુલામીમાં પડેલા છે તેમને પણ મુક્ત કરી આપજે. તારા પ્રતિ લઈ જતા માર્ગમાંનાં આ વિઘ્નો ભયંકર છે અને સાથે સાથે નિઃસત્ત્વ પણ છે; જે લોકો હજી તેમને વિવશ પડેલા છે તેમને માટે એ ભયંકર છે, જે તેમનાથી પર થઈ ગયેલા છે તેમને માટે તે નિઃસત્ત્વ છે.

અમે જ્યારે અમારા પોતાના વિષેની ચિંતામાંથી, અમારા જીવન વિષેની, અમારા આરોગ્ય વિષેની, અમારી તૃપ્તિ વિષેની, તથા અમારી પ્રગતિ વિષેની પણ, ચિંતામાંથી મુક્ત થઈ જઈએ છીએ અમે પછી જે અપાર રાહત અનુભવાય છે, જે મધુર હળવાશ અનુભવાય છે એને કેવી રીતે વર્ણવી શકાય.

આ રાહત, આ મુક્તિ તેં મને આપી છે, ઓ દિવ્ય ગુરુ, હે મારા